

પ્રેસનોટ

તા - ૯ જાન્યુઆરી ૨૦૧૩

પ્રતિ શ્રી,

તંત્રી

ગુજરાતીલેક્સિકોનની સાતમી વર્ષગાંઠ નિમિત્તે ભાષાપ્રેમીઓ માટે ઝ્લોબલ ગુજરાતીલેક્સિકોનની ભેટ

13 જાન્યુઆરી 2013ના રોજ ગુજરાતીલેક્સિકોન તેની સફરના 6 વર્ષ પૂર્ણ કરે છે અને સાતમા વર્ષની સફરના પ્રારંભે સૌ ભાષા પ્રેમીઓ માટે ઝ્લોબલ.ગુજરાતીલેક્સિકોનની ભેટ અર્પે છે.

ભાષાને કોઈ જ સીમા કે સરહદ કે એલઓસી (લાઇન ઓફ કન્ટ્રોલ) નથી. ભાષાને કોઈ જ બંધનમાં બાંધી શકાય નહીં. ગુજરાતી ભાષાના સંવર્ધન અને વિસ્તૃતીકરણ સાથે અન્ય ભાષાના શબ્દોનો સ્વીકાર એ ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા તરફનું પગથિયું છે.

આજે વૈશ્વિક વ્યાપારીકરણના આ માહોલમાં જ્યારે જાપાન અને ચીન જેવા એશિયાઈ દેશોમાંથી વેપારની અજોડ તકો લઈને ગુજરાત આવતા ત્યાંના રહેવાસીઓ જોડે આપણે આપણી ક્ષિતિજ વિસ્તારવી હશે તો તેમની ભાષા - સંસ્કૃતિ જાણવી અને સમજવી પણ પડશે. આ તાતી જરૂરિયાતને સમજીને શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળની ગુજરાતીલેક્સિકોન ટીમ 5000 જેટલા શબ્દો ધરાવતો ગુજરાતી - જાપાનીઝ અને ગુજરાતી - ચાઇનીઝ શબ્દનો શબ્દકોશ global.gujaratilexicon.comના નામે રજૂ કરે છે.

સાઇટ ઉપર તમને ગુજરાતી શબ્દોનો અંગ્રેજી અર્થ ઉપરાંત તેનો જાપાનીઝ અર્થ રોમાજીમાં અને તેનું ગુજરાતી ઉચ્ચારણ અને ચાઇનીઝ અર્થ ફિનિનમાં અને તેનું ગુજરાતી ઉચ્ચારણ મળશે. વધુમાં નમૂનારૂપ કેટલાંક વાક્યો પણ જોવા મળશે.

ઉદા. તરીકે જોઈએ તો આપણે કોઈનો આભાર માનવો હશે તો ગુજરાતીમાં કહીશું કે 'તમારો આભાર' આજ વાક્ય અંગ્રેજીમાં કહીએતો કહેવાય કે 'Thank You' આ જ વાક્યને જાપાનીઝમાં 'આરીગાતો ગોઝાઇમાસ' અને જો ચાઇનીઝમાં કહેવું હોય તો 'શીએશીએ' કહેવાય.

આ ઉપરાંત 2013ના સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતીલેક્સિકોન 13 નવા પ્રકલ્પો રજૂ કરવાની ખેવના રાખે છે જે આ મુજબ છે.

1. Gujarati - Japanese Dictionary

2. Gujarati - Chinese Dictionary
3. GL YouTube Channel
4. New Games
5. Gujaratilexicon Mobile Application
6. Graphical Interface Of GL Web Portal
7. Law Dictionary
8. Medical Dictionary
9. Technical Dictionary
10. Sanskrit - Gujarati Dictionary
11. Urdu - Gujarati Dictionary
12. Graphical Computer Ni Clicke
13. GL Books

આ ઉપરાંત ગુજરાતીલેક્સિકોનનો સમગ્ર ડેટાબેઝ તેના ડાઉનલોડ પેજમાં નિશુલ્ક ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે જેમાં ભગવદ્ગોમંડલનો પણ સમાવેશ થઈ જાય છે.

ગુજરાતીલેક્સિકોન હંમેશા તેના વાચકગણનું આભારી છે કે જેમના ભાષાપ્રેમ અને મૂલ્યવાન પ્રતિભાવોને કારણે ગુજરાતીલેક્સિકોન આજે તેની સાતમી સફરના પગરણ કરે છે.

info@gujaratilexicon.com ઉપર ગુજરાતીલેક્સિકોન ટીમનો સંપર્ક સાધી શકાય છે.